

**Date: May 27, 2022**

To The Manager, Listing Department, <b>National Stock Exchange of India Limited, (NSE)</b> Exchange Plaza, C-1, Block-G, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai-400 051.	To The Manager, The Department of Corporate Service, <b>BSE Limited, (BSE)</b> Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001.
<b>Symbol – LINCOLN</b>	<b>Scrip Code – 531633</b>

Dear Sir / Madam,

**Sub: Newspaper Advertisement for transfer of equity shares to Investor Education Protection Fund Authority (IEPF Authority).**


With reference to the above captioned subject matter, pursuant to the provisions of section 124 (6) of the Companies Act, 2013 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of notice published in the newspaper on May 27, 2022 as required under Rule 6 of IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and amendments thereof, inviting attention of concerned shareholders to lodge their claims in respect of unclaimed dividends for last seven consecutive years, failing which their equity shares would be transferred to IEPF Authority.

We request you to kindly take the above information on your record.

Thanking you,

Yours faithfully,

**For Lincoln Pharmaceuticals Ltd**

*H.A. Desai*  


**Niren A. Desai**  
**Company Secretary &**  
**Compliance Officer**

Encl: a/a

### MENA MANI INDUSTRIES LIMITED

Regd. Office : 4th Floor, "KARM" Corporate House, Opp. Vikramnagar, Nr. Newyork Timber Mart, Ambli Bopal Road, Ahmedabad - 380059, Gujarat. Phone : 079-26936006 • CIN : L29199G1992PLC018047

#### STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022 (Rs. in Lacs)

Particulars	Quarter Ending	Year to date Figures	Corresponding 3 months ended in the previous year
	31/03/2022 Audited	31/03/2022 Audited	31/03/2021 Audited
Total Income from operations	1134.08	2682.63	339.62
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	130.89	144.35	(106.16)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	130.89	144.35	(106.16)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	102.26	115.72	(143.93)
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	102.26	115.72	(143.93)
Equity Share Capital	1003.47	1003.47	1003.47
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)			
Basic:	1.02	1.15	(1.43)
Diluted:	1.02	1.15	(1.43)
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualised)			
Basic:	1.02	1.15	(1.43)
Diluted:	1.02	1.15	(1.43)

NOTES: The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website ([www.bseindia.com](http://www.bseindia.com)) and the company's website (<http://www.menamani.in/>)

For, MENA MANI INDUSTRIES LIMITED  
SD/- Jayesh Jayantilal Pandya  
(Director) DIN : 02030546  
Date : 26/05/2022  
Place : Ahmedabad

### CHANGE OF NAME

I Myself, Patel Hasmukhbhai Keshabhaji, today say that my son Whose old Name was Patel Nivkumar Hasmukhbhai has been Changed to a New Name Patel Niv Hasmukhbhai

Add.30, Sahila Bungalows, Mahakali Mandir Road, Himmatnagar, Ta. Himmatnagar, Dist. Sabarkantha. Pin-383001

### WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION

VARIOUS WORKS OF GAS FITTING AND EQUIPMENT IN PANTRY CAR

For and on behalf of President of India, Divisional Railway Manager (Mechanical), Bhavnagar Para, Western Railway, invites Open Tenders under "SINGLE PACKET SYSTEM" in prescribed tender forms from reputed contractors with adequate experience and financial capability for the under mentioned work through IREPS website [www.ireps.gov.in](http://www.ireps.gov.in) Tender Notice No. M 442/PC AMC/PBR/06/2021 Retender (1) Name of work with its location: Contract for "Annual Maintenance, Servicing and Repairing of Gas Fitting and Equipment in Pantry Car at Porbandar Coaching Depot for three years." (2) Approximate Cost of the Work: ₹ 7,28,455.74/- (Seven Lakh Twenty Eight Thousand Four Hundred Fifty Five Rupees and Seventy Four Paise) (3) Earnest Money to be deposited: ₹ 14,600.00 (4) Date & Time of closing of Tender and Opening of tender: 15:00 hrs. on 21-06-2022 and 15:30 on 21-06-2022 (5) Office Address: Divisional Railway Manager (Mechanical), Bhavnagar Para. Website particulars: [www.ireps.gov.in](http://www.ireps.gov.in) BVP-013

Follow us on: [twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

## MUFG Receives Approval to Open GIFT Branch in India

Tokyo, MUFG Bank announced that it has become the first Japanese bank to obtain approval to open a branch (GIFT Branch) in the Gujarat International Financial Tec-City (GIFT City) from the International Financial

The government has rolled out tax incentives, such as a zero withholding tax and a 10 year corporate tax holiday, which have led many foreign financial institutions to open offices in GIFT City.

In India, regulations in principle prohibit extending foreign currency-denominated loans, but GIFT City provides an opportunity to book India-linked offshore business within India which we believe will enable us to meet diverse funding needs of customers in a market where future growth is expected. In addition, foreign currency lending operations, hitherto mainly conducted from outside India, can now be processed within the country. This, together with an expected simplification of procedures, will improve di-



**Tapan Ray**  
MD & Group  
CEO, GIFT City

Services Centres Authority in India and the Financial Services Agency in Japan. We will proceed with preparations to open the GIFT Branch.

As part of the Indian government's vision to make India a hub for international financial services, it established GIFT City in Gujarat State, western India, as a financial and IT special zone with an international financial service centre for offshore transactions. GIFT City encourages banks and investors to return business currently overseas to India.

### LINCOLN PHARMACEUTICALS LIMITED

CIN: L24230GJ1995PLC024288

Regd. Office: "LINCOLN HOUSE", Behind Satyam Complex, Science City Road, Sola, Ahmedabad - 380060.  
Phone: +91-79 6777-8000 Fax: +91-79 6777-8062  
E-Mail: [info@lincolnpharma.com](mailto:info@lincolnpharma.com) Website: [www.lincolnpharma.com](http://www.lincolnpharma.com)

#### Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund Authority

NOTICE is hereby given pursuant to the provisions of section 124 (6) of the Companies Act, 2013 ("the Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016 ("the Rules") as amended from time to time. As per the Rules, the company needs to transfer the shares held by the shareholders either in physical form or dematerialized form to the Investor Education and Protection Fund Authority ("IEPF Authority") in respect of which dividends has not been claimed for seven consecutive years or more.

In accordance with the provisions of the Rules, shareholders may note that the unclaimed / unpaid dividend for the financial year 2014-2015 would be transferred to IEPF Authority along with underlying shares in respect of which dividend has not been claimed for seven consecutive years from the financial year 2014-2015 onwards. Adhering to the various requirements set out in the Rules, individual notices have already been sent to the respective shareholders at their latest available address in the records of the Company / Registrar and Share Transfer Agent ("RTA"), inter alia providing the details of shares being transferred to IEPF Authority and list of such shareholders are available on the website of Company and can be accessed at [www.lincolnpharma.com](http://www.lincolnpharma.com).

The concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the company would be issuing new share certificate(s) in lieu of the original certificate(s) held by such shareholder for the purpose of transfer of shares to IEPF Authority and upon such issue, the Company shall inform the depository by way of corporate action to convert the new share certificate(s) into demat form and transfer in favour of IEPF Authority. The original share certificate(s) which are registered in the name of shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. The concerned shareholders holding shares in dematerialized form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the demat account of the IEPF Authority.

For claiming of unpaid / unclaimed dividend, the concerned shareholder may request on or before August 31, 2022 to the Company's RTA i.e. M/s. Link Intime India Pvt. Ltd., 506 to 508, 5<sup>th</sup> Floor, Amarnath Business Centre (ABC-1), Nr. St. Xavier's College Corner, Off. C.G. Road, Navrangpura, Ahmedabad-380009, Tel.No.: 079 26465179, Email: [iepf.shares@linkintime.co.in](mailto:iepf.shares@linkintime.co.in). The Company shall with a view to adhering with the Rules, transfer the shares to the IEPF Authority by the due date. Consequent thereto, no claim shall lie against the Company in respect of such unpaid / unclaimed dividend and underlying shares. The concerned shareholder may note that upon such transfer, they can claim the said shares along with dividend(s) including all benefits on such shares, if any, from IEPF Authority, details of which are available at [www.iepf.gov.in](http://www.iepf.gov.in).

For, Lincoln Pharmaceuticals Limited  
SD/-  
Niren A. Desai  
Place: Ahmedabad  
Date: May 26, 2022  
Company Secretary & Compliance Officer

L&T Finance Limited  
Registered Office: 15<sup>th</sup> Floor, PS Srijan Tech Park  
Plot No. 52, Block DN, Sector V, Salt Lake City  
Kolkata 700 091, District 24-Parganas North.  
CIN No.: U65910WB1993FC060810  
Branch office: Vadodara



#### DEMAND NOTICE

Under Section 13(2) of Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act 2002 (Herein after referred to as The Act)

We have issued Demand Notice under Section 13(2) of the Act to you all (Borrowers, Co-borrowers & Guarantors) through Registered Post Acknowledged Due, as you have defaulted in payment of interest and principal instalments of your loan account, and have failed and neglected to clear the said outstanding dues. As a result, the loan account has been classified as Non-Performing Asset (NPA) in the book of account in accordance with the directives relating to asset classification issued by the Reserve Bank Of India. The Notice has been returned as "undelivered" and therefore we are now issuing this notice to you all under 13(2) of the Act and hereby calling upon to repay the amount mentioned in the notice appended below to the L&T Financial Services. (Formerly known as L&T Housing Finance and merged with L&T Finance Limited ("LTF") w.e.f. 12th April, 2021) within the period of 60 Days from the date of this Paper Notification together with further interest and other charges from the date of Demand Notice till payment or realization. In case you are not discharging your liabilities under the terms of this notice, we shall be constrained to exercise all or any one of the rights conferred under Section 13(4) or Section 14 of the Act. "This is without prejudice to any rights available to us under the Act and/or any other law in force from time to time."

Loan Account Number	Borrower's & Co-borrower's Name	Demand Notice date / NPA date / Outstanding Amount		Description of the Immovable Property (Mortgaged)
		NPA Date	Outstanding Amount (₹) As On	
H014382912200717 03, H014383012200719 23, H014383012200740 00	1. Kamalbhaji Keshmal Tirhand 2. Ritu Kamal Tirhandi	Demand Notice Date: 18.04.2022 NPA Date: 05.03.2022	total amount of Rs. 34,63,732.69/- (Rupees Thirty Four Lakhs Sixty Three Thousand Seven Hundred Thirty Two and Paise Sixty Nine Only) As On Date 16-04-2022	Schedule-I All The Piece And Parcel Of The Property Address: Flat No. 102 On The First Floor, Admeasuring 78.97 Sq.mtrs (850 Sq.feet) Built Up Area In Krish Residency Constructed On Block/plot No. E-55 Admeasuring 52.57 Sq.Mtrs And Block No. C-22 Admeasuring 131.78 Sq.mtrs In Krishna Leela Society Situated In Revenue Survey No. 374 In The Sim Of Village Savad, District & Sub District Vadodara, Gujarat 390019
				Boundaries East: Krishna Society No. C-21 West: Krishna Society No. C-23 North: Krishna Society No. 54 South: Flat No. 101

Date: 27.05.2022  
Place: Vadodara

SD/-  
Authorized Officer  
For L&T FINANCE LIMITED

### SHREE NARMADA ALUMINIUM INDUSTRIES LIMITED

Reg. Office : 95/1, Bharuch-Palej Road, Bholav, Dist: Bharuch, Gujarat - 392001  
Tel: 912642260624 E-mail : [nalexhbh@yahoo.co.in](mailto:nalexhbh@yahoo.co.in) CIN : L91110GJ1981PLC004269

#### STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH 2022 (Rs. In Lakhs)

Particulars	Quarter Ended			Year Ended		
	31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.2021	
	Audited	Unaudited	Audited	Audited	Audited	
Other Income	0.00	0.00	5.93	0.00	5.94	
Profit for the period	-2.88	-2.62	4.38	-8.08	1.27	
Remeasurement of the defined benefit plan	0.00	0.00	0.00	0.00	0.07	
Total Comprehensive Income (IX+X)	-2.88	-2.62	4.38	-8.08	1.35	
Paid up Equity Share Capital (FV 10/share)	52.96	52.96	52.96	52.96	52.96	
Earnings Per Share (Basic+Diluted)	-0.55	-0.50	0.84	-1.55	0.24	

Note :- The above extract Financial Results for the quarter and nine months ended 31.03.22 filed with the stock exchange under Regulation 33 of the SEBI (LODR) Regulation 2015. The full format of the same with the notes are available on the web site of the stock exchange as [www.bseindia.com](http://www.bseindia.com) and company website [www.snaib.in](http://www.snaib.in)

For and on behalf of Board of Directors  
Kantilal B. Patel Milan R Patel  
Chairman & M.D. - CEO Director and CFO  
Place : Mumbai  
Date : 26.05.2022

### JAYATMA ENTERPRISES LIMITED

(Formerly known as Jayatma Spinners Limited)  
Regd. office :- 2nd Floor, 1, Laxminagar Co-op Hou. Soc. Ltd., B/S Naranpura Post Office, Naranpura, Ahmedabad - 380013 Website :- [www.jayatmaenterprises.com](http://www.jayatmaenterprises.com)  
Mail us on :- [cs@jayatma.com](mailto:cs@jayatma.com) Ph. No. :- 079 - 27682700 CIN : L17110GJ1979PLC003355

#### EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE FOURTH QUARTER/YEAR ENDED ON 31.03.2022 (RS. IN LACS)

Sr. No.	PARTICULARS	Quarter Ended			Year Ended	
		31.3.2022 (Audited)	31.12.2021 (Unaudited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)
1	Total income from operations (net)	21.00	18.60	17.72	85.4	96.33
2	Net Profit / (Loss) from ordinary activities before tax, exceptional and/or extra ordinary items	6.72	9.26	8.08	41.17	40.53
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	6.72	9.26	8.08	41.17	40.53
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	8.47	4.43	0.89	29.32	29.33
5	Equity Share Capital	300.00	300.00	300.00	300.00	300.00
6	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)					315.19
7	Earning Per Share (In rupees before/after extraordinary items) (of Rs. 10/- each)					
	Basic :	0.28	0.15	0.03	0.98	0.98
	Diluted :	0.28	0.15	0.03	0.98	0.98

Note: The above is an extract of the detailed format of Standalone Audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone Audited Financial Results are available on the Company's website i.e. [www.jayatmaenterprises.com](http://www.jayatmaenterprises.com) and website of stock exchange i.e. [www.bseindia.com](http://www.bseindia.com).

By Order of the Board  
For, Jayatma Enterprises Limited  
SD/- Nirav K. Shah (DIN : 00397336)  
Chairman & Managing Director  
Date : 26.05.2022  
Place : Ahmedabad.

### DENIS CHEM LAB LIMITED

[CIN: L24230GJ1980PLC003843]  
Registered Office: Block No. 457, Village: Chhatral, Tal: Kalol (N.G.) Dist: Gandhinagar - 382 729

#### EXTRACT OF STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/ YEAR ENDED ON 31ST MARCH, 2022 (Rs.in Lakh)

Particulars	Quarter ended on	Year ended on	Quarter ended on
	31-03-2022 (Audited)	31-03-2022 (Audited)	31-03-2021 (Audited)
Total income from operations (Net)	3777.44	13655.65	2,771.65
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	150.47	888.34	(45.72)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	150.47	888.34	(45.72)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	94.28	626.30	(28.83)
Total Comprehensive Income for the period	94.28	598.75	(13.54)
Equity Share Capital	1387.67	1387.67	1,387.67
Reserves (Excluding Revaluation Reserves)	-	5257.46	-
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
Basic & Diluted:	0.68	4.51	(0.21)

Notes:-  
1 The above is an extract of the detailed format of Annual Financial Results filed with BSE Limited under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.  
2 The full format of Annual Financial Results is available on the website of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and also on the website of the Company.

For DENIS CHEM LAB LIMITED  
HIMANSHU C. PATEL  
MANAGING DIRECTOR  
Din No. : 00087114  
Date : 26th May, 2022  
Place : Ahmedabad

## L&T named Second Strongest Global Engineering & Construction Brand

Mumbai, Larsen & Toubro (L&T), an Indian multinational engaged in EPC Projects, Hi-Tech Manufacturing and Services, has been named as the "Second Strongest Brand" among the top 50 Global Engineering and Construction (E&C) companies - by Brand Finance, the world's leading brand valuation consultancy.

L&T has also been ranked as the "Third Fastest Growing Brand" by the London-based consultancy in its 'Engineering & Construction 50 - 2022' report. It is the only Indian company among the 'Most Valuable Global E&C Firms'. L&T with its footprint across 50 countries has gained 44% in its Brand Value over last year.

Commenting on this achievement, an L&T spokesperson said, "Brand is about so much more than just a name or a logo. It's about trust, reputation, value systems and credibility. We are honoured to be recognized as the Second Strongest Global Brand in the Engineering and Construction space by Brand Finance. This recognition is a testament to our team's commitment to excellence and our clients' trust in our ability to deliver on our promises." "We are excited to see what the future holds for our brand and our business. With continued growth and expansion into new markets and new sectors, we are confident that we will continue to build on our strong foundation and solidify our position as a leading player in the global industry."

L&T achieved a significant improvement in its brand strength, with its Brand Strength Index (BSI) increasing by 7.1 points, to 83.9 out of 100, with a corresponding rating of AAA. Among the 'Most Valuable E&C 50 2022' brands L&T is the only Indian brand present there.

GOVERNMENT OF INDIA, MINISTRY OF RAILWAYS  
RAILWAY RECRUITMENT CELL Parcel Depot,  
Alibhai Premji Road, Grant Road (East), Mumbai - 400 007.

INDICATIVE NOTIFICATION FOR ENGAGEMENT OF APPRENTICES IN WESTERN RAILWAY

Notification No. RRC/WR/01/2022 Apprentice Dated 26/05/2022

Opening Date and Time	28/05/2022 @ 11.00 hrs.
Closing Date and Time	27/06/2022 @ 17.00 hrs.

1. Western Railway invites ONLINE applications from interested Applicants for engagement as Act Apprentices against the 3612 slots notified for training in the designated Trades under Apprentice Act 1961 at various Divisions, Workshops and Units within the jurisdiction of Western Railways for the year 2022-2023. 2. Applications complete in all respect should be submitted online only till 17.00 hrs. on 27/06/2022. 3. For further details, log on to RRC-WR's website: <https://www.rcc-wr.com>

Skill India  
WESTERN RAILWAY  
www.wr.indianrailways.gov.in  
Azadi Ka Amrit Mahotsav  
0125

PUBLIC NOTICE

This is to inform the general public that original share certificate no. 56 distinctive numbers from 66 to 70 of Mrs. Bhagwanti Murajmal Gurnani, a member of Kailash Tower Co-op. Housing Society Ltd. having address at A-8/9, Kailash Tower, Stadium Road, Navrangpura, Ahmedabad - 380009 have been misplaced. The member of the society has applied for duplicate shares. The society hereby invites claims and objections from claimants/objectors or objectors for issuance of duplicate Share Certificate within the period of 14 (fourteen) days from the publication of this notice, with copies of such documents and other proofs in support of his/her/their claims/objectors for issuance of duplicate Share Certificate to the Secretary of Kailash Tower Co-op. Housing Society Ltd. If no claims/objectors are received within the period prescribed above, the society shall be free to issue duplicate Share Certificate in such manner as is provided under the by-laws of the society. The claims/objectors, if any, received by the society shall be dealt within the manner provided under the by-laws of the society.

For and on behalf of  
Kailash Tower Co-op. Hsg. Soc. Ltd.  
Date : 27-05-2022 Place : Ahmedabad

### MINAXI TEXTILES LIMITED

CIN : L17119GJ1995PLC025007  
Regd. Office : Plot No.3311, GIDC, Phase IV, Chhatral, Taluka Kalol, Gandhinagar 382729

#### EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.03.2022

Sr. No.	Particulars	For the Quarter ended	For the Quarter ended	For the Quarter ended	Year ended	Year ended
		31/03/2022 (Audited)	31/12/2021 (Unaudited)	31/03/2021 (Audited)	31/03/2022 (Audited)	31/03/2021 (Audited)
1	Total Income from Operations	1104.35	1061.8	910.78	3118.4	1485.46
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-81.07	-79.8	0.56	-206.23	-192.72
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-81.07	-79.8	0.56	-206.23	-192.72
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-59.45	-65.12	-5.71	-159.06	-160.36
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-58.92	-64.85	-5.18	-157.71	-161.18
6	Equity Share Capital	494.16	494.16	494.16	494.16	494.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0	0	0	0	0
8	Earnings Per Share (of Rs. 1/- each (for continuing and discontinued operations)) 1. Basic: 2. Diluted:	-0.12	-0.13	-0.01	-0.32	-0.32

NOTES :  
1 The above Audited Financial Results for the Quarter and Year ended on 31st March 2022 have been reviewed by the Audit Committee, and have been considered and approved by the Board of Directors at its meeting held on 26th May, 2022. The Financial Results for the year ended on 31st March, 2022 were audited by the Statutory auditor, who has issued an un modified report thereon. While placing this financial results before the Board, the Managing Director and the Chief Financial Officer Who has issued certificate as required under Regulation 33(2)(a) of the SEBI (LODR) Regulations, 2015.  
2 As informed earlier to BSE the company has Transfer and dematerialized 1485600 Unclaimed Shares on 02.11.2021 in dmate account namely "Minaxi Textiles Limited- Unclaimed Suspense Account held with Shah Investor's Home Limited (SIHL) in compliance with Schedule VI r/w Regulation 39(4) of the SEBI (LODR) Regulations, 2015. Out of which 171000 Shares were claimed by shareholders which are transferred them through corporate action by RTA on 08.04.2022. Now the company has 1314600 remaining Unclaimed Shares in Dmate account namely "MINAXI TEXTILES LIMITED UNCLAIMED SUSPENSE ACCOUNT".  
3 The company has considered possible effects that may result from the COVID-19 pandemic in preparation of these financial results including the recoverability of its assets comprising Property, Plant and Equipment, Trade Receivables, and Inventories. In developing the assumptions relating to future uncertainties in the economic conditions due to the COVID-19 pandemic, it has at the date of approval of these financial results, used relevant internal and external sources of information, including economic forecast and expect that the carrying amount of these assets are recoverable. The impact of COVID-19 may be different from that estimated as at the date of approval of these financial results, the company will continue to monitor any material changes to future economic conditions.  
4 The financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IND AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India.  
5 Figures for the previous periods have been regrouped wherever considered necessary.  
6 The company is engaged in single segment of business i.e. Textiles and hence only one reportable operating segment as per Ind AS 108 - Operating segments.  
7 Figures for the quarter ended 31st March, 2022 and 31st March, 2021 represents the difference between the audited figures in respect to the full financial year and the published unaudited figures up to the end of the third quarter of the current financial year and previous financial year respectively, which were subjected to a limited review.  
8 The company has incurred cash losses in current year and preceding financial year. During the year the company has executed debt restructuring scheme and restructured its overall borrowings. This will result into substantial reduction in the interest outflow for future period and has extended the repayment plan in relation to restructured borrowings. Further, the Company expects to generate operational cash-inflows in near future, which will support the Company to meet its near future cash obligations. Taking these factors into consideration, the Company believes financial information is fairly presented on going concern basis.  
9 The Company is not a Large Corporate as per the applicability criteria given under the SEBI circular SEBI/HO/DDHS/CIR/P/2018/144 dated November 26, 2018.

For and on behalf of the Board  
MINAXI TEXTILES LIMITED  
Dineshkumar P Patel  
(Managing Director)  
DIN : 02268757  
Place : Chhatral  
Date : 26/05/2022

